

# નગર આયોજન અને મુલ્યાંકન ખાતુ

## અમદાવાદ શાખા કચેરી

બહુમાળી ભવન-૨, ચોથો માળ, વસ્ત્રાપુર સરકારી વસાહત પાસે, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ-૩૮૦૦૫૨.

Email:-tpvd.ahdbranch@gmail.com

ટેલીફોન નં.૦૭૯ ૨૭૯૧૦૧૫૫

નં.એન.એ.બી.પી./પીપળી/ઘોલેરા/૨૦૨૬/ ૨૨૮

તા.૦૩/૦૧/૨૦૨૬

પ્રતિ,

Kavvan Developers Pvt.Ltd.  
Company through its Director  
Vivek Shambhudayal Khandelwal

સર્વે નં. ૧૨૯/૧, ૧૩૦

મુ.પો. પીપળી, તા.ઘોલેરા,

જિ. અમદાવાદ.

**વિષય:-મોજે.પીપળી, તા.ઘોલેરા, જી.અમદાવાદના સીટી સર્વે નં. NA૧૨૯/૧, NA૧૩૦ (જુના સ.નં./બ્લોક નં.૭૩૧, ૭૩૨/૨) ની જમીનમાં તાંત્રિક અભિપ્રાય બાબત.**

**સંદર્ભ:-** આપશ્રીની તા.૨૮/૧૧/૨૦૨૫ તેમજ તા.૩૧/૦૧/૨૦૨૬ ની અરજી અન્વયે.

શ્રીમાન,

ઉપરોક્ત વિષયાન્વયે જણાવવાનું કે, મોજે.પીપળી, તા.ઘોલેરા, જિ.અમદાવાદના સીટી સર્વે નં. NA૧૨૯/૧, NA૧૩૦ (જુના સ.નં./બ્લોક નં.૭૩૧, ૭૩૨/૨) ની ૨૮,૨૫૫.૦૦ ચો.મી. જમીનમાં રહેણાંક (DW-1+DW-2) + RELIGIOUS (REG) હેતુ માટેના લે-આઉટ પ્લાન તાંત્રિક ચકાસણી સારૂ આપે અત્રે રજુ કરેલ છે. સદર જમીનના લે-આઉટ પ્લાનને સક્ષમ અધિકારીશ્રી દ્વારા મંજૂર કરવા બાબતે અત્રેનો તાંત્રિક અભિપ્રાય નીચે દર્શાવેલ શરતોને આધિન આપવામાં આવે છે.

**શરતો:**

૧. સૌ પ્રથમ સદર જમીનમાં સદર સુચિત હેતુ બાબતે જિલ્લા કલેક્ટરશ્રી પાસેથી બિનખેતીની મંજૂરી મેળવી લેવાની રહેશે તથા તેની શરતોને આધિન જરૂરી લાગતી પ્રક્રિયા કરવાની રહેશે અને ત્યારબાદ જ વિકાસ પરવાનગી મેળવી બાંધકામ કરવાનું રહેશે.
૨. જિલ્લા કલેક્ટરશ્રી, અમદાવાદના હુકમ નં. (૧) ૯૧૭/૦૭/૧૩/૦૪૨/૨૦૨૩, તા.૧૦/૦૨/૨૦૨૩ (૨)૨૦૧૯/૦૭/૧૩/૦૪૨/૨૦૨૩, તા.૦૩/૦૩/૨૦૨૩ ના બિનખેતી હુકમમાં જણાવેલ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
૩. અરજદારશ્રી દ્વારા રજુ કરેલ ડી.આઇ.એલ.આર. કચેરી, અમદાવાદની તા.૧૩/૦૮/૨૦૨૪ ની અરજી નં.- ૭૦૭૧૩૨૦૨૪૧૧૬૪૩૩, ૭૦૭૧૩૨૦૨૪૧૧૬૪૪૭, ૭૦૭૧૩૨૦૨૩૨૧૩૩૩, ૭૦૭૧૩૨૦૨૩૨૮૨૫ તથા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ તા.ધંધુકા, જી.અમદાવાદના તા.૧૦/૦૯/૨૦૨૫ ની અરજી નં.- ૭૦૭૧૩૨૦૨૩૨૧૩૩૩ ની માપણી શીટ મુજબની હદ પ્રમાણે સદર તાંત્રિક અભિપ્રાય આપવામાં આવેલ છે, સવાલવાળી જમીનની હદો તથા સુચિત પ્લોટો સહિતની અધિકૃત ફેર માપણી સંબંધિત દ્વારા કરાવી લેવાની રહેશે જો હદો/વિગતોમાં વિસંગતતા ઉપસ્થિત થાય તો આ અભિપ્રાય રદ ગણવાનો રહેશે તથા અત્રેનો ફેર અભિપ્રાય મેળવી તેને આધિન જ બાંધકામ પરવાનગી અંગેની આગળની કાર્યવાહી કરવાની રહેશે.
૪. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ અને અધિક મામલતદારની કચેરી, તા.ધંધુકા, જી.અમદાવાદના તા.૧૫/૧૦/૨૦૨૫ ના પત્ર નં.સીટીએસ/પીપળી(બિનખેતી)/હિસ્સા માપણી/સી.સ.નં. NA૧૨૯/૨૦૨૫ ની વિગતોને આધિન સદર અભિપ્રાય પાઠવેલ છે. તેમજ તેમાં વિસંગતતા ઉદભવેથી અત્રેની કચેરીનો અભિપ્રાય રદ ગણવાનો રહેશે.
૫. સવાલવાળી જમીનમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ, ૧૯૭૬ ની જોગવાઈ હેઠળ હાલની સ્થિતિએ કોઈ વિકાસ યોજના બનેલ નથી. જેથી સવાલવાળી જમીનમાં ઝોનીંગની કોઈ દરખાસ્ત નથી. સવાલવાળી જમીનને સરકારશ્રીના પ્રવર્તમાન સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમો-૨૦૧૭ મુજબ ડી-૧૦ કેટેગરીમાં ધ્યાને લઈને સદરું તાંત્રિક અભિપ્રાય આપવામાં આવે છે.

૬. પ્રસ્તુત પ્રકરણે અત્રેથી હાલે કોઈ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ પરવાનગી આપવામાં આવેલ નથી. આ ફક્ત લે-આઉટ પ્લાનનો તાંત્રિક અભિપ્રાય છે તથા આનાથી બાંધકામની મંજૂરી મળતી નથી. સંબંધિત સ્થાનિક સંસ્થા પાસેથી જે તે પ્રકારની બાંધકામ પરવાનગી/રજાચિઠ્ઠી મેળવી લેવાની રહેશે. વપરાશ પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ વપરાશ ચાલ કરવાનો રહેશે.
૭. સવાલવાળી જમીનને સંબંધિત સ્થાનિક સંસ્થાએ બાંધકામ પરવાનગી આપતા પહેલા અત્રેથી આપેલ તાંત્રિક અભિપ્રાયને હેતુ તથા કલેક્ટરશ્રી/જીલ્લા/ તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા પાઠવેલ બિનખેતી હુકમમાં જણાવેલ હેતુ સુસંગત કયાં બાદ જ બાંધકામ પરવાનગી બાબતે નિર્ણય લેવાનો રહેશે.
૮. સવાલવાળી જમીનમાં જો રી સર્વેની કામગીરી પૂર્ણ થઈ અમલમાં હોઈ અને તેને લઈને જમીનની હદ કે ક્ષેત્રફળ માં કોઈપણ ફેરફાર થતો હોય તો તે મુજબનો અત્રેની કચેરીનો ફેર અભિપ્રાય મેળવી લેવાનો રહેશે.
૯. આ અભિપ્રાયના કારણે સવાલવાલી જમીનમાં અરજદારની માલિકી તથા જમીન હદ વિસ્તાર તથા ક્ષેત્રફળ અંગેની મંજૂરી મળતી નથી. પરંતુ નિયમાનુસાર લે-આઉટ પ્લાન અંગેનો તાંત્રિક જ અભિપ્રાય આપવામાં આવેલ છે. અરજદારની માલિકી તથા જમીનની હદ, વિસ્તાર, ક્ષેત્રફળ અંગે સંબંધિત ખાતા પાસેથી ચકાસણી કરાવવાની રહેશે અને જો તેમાં વિસંગતતા જણાય તો સદર અભિપ્રાય રદ ગણવાનો રહેશે.
૧૦. સવાલવાળી જમીનમાંથી અથવા નજીકથી પસાર થતાં વર્ગીકૃત રસ્તાથી છોડવા પડતા અંતર માટે સંબંધિત ખાતા પાસેથી વાંધા રહિત પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને તે પ્રમાણે સ્થળ પર અંતર છોડી બાંધકામ કરવાનું રહેશે.
૧૧. લે-આઉટ પ્લાનમાં દર્શાવેલ માર્જીન તથા ખુલ્લી જગ્યાઓ સ્થળ ઉપર છોડવાની સંપૂર્ણ જવાબદારી જમીન માલિકની રહેશે.
૧૨. સવાલવાળી જમીનમાંથી અથવા નજીકથી પસાર થતી/અરજદારશ્રી દ્વારા રજુ કરેલ માપણીશીટ/પ્લોટ બુક/ટીપ્પણમાં દર્શાવેલ હોય/કે ન દર્શાવેલ હોય તેવી, સવાલવાળી જમીનોમાં હયાત હાઇટેન્શન/ ઇલેક્ટ્રીક લાઇન, વર્ગીકૃત રસ્તા, કેનાલ/વોટર કોર્સ/નદી/વહોળા/તળાવ કે અન્ય વોટર બોડી, રેલ્વે લાઇન, તેલ/ ઓ.એન.જી.સી. કુવા, પાઇપ લાઇન, ગેસ લાઇન, પેટ્રોલીયમ લાઇન વિગેરેની હયાતી તથા મધ્ય કે હદ રેખાથી છોડવી પડતી કન્ટ્રોલ લાઇન તથા માર્જીન અંતરે બાબત અંગે સંબંધિત સક્ષમ અધિકારીશ્રીનો અભિપ્રાય મેળવ્યા બાદ જ તે મુજબ સ્થળ પર અંતર છોડી બાંધકામ કરવાનું રહેશે. તેમજ તેમાં વિસંગતતા ઉદ્ભવેથી અત્રેની કચેરીનો અભિપ્રાય રદ ગણવાનો રહેશે.
૧૩. લે-આઉટ પ્લાનમાં દર્શાવ્યા મુજબ બાંધકામના માપો, માર્જીનના અંતરો, રસ્તાની લંબાઈ/પહોળાઈ, બાંધકામ નિયંત્રણ રેખા વિગેરેના માપો સ્થળ પર લે-આઉટ પ્લાન મુજબ મળી રહેતા હોય તો જ જમીન માલિકશ્રીએ બાંધકામ કરવાનું રહેશે.
૧૪. લે-આઉટ પ્લાનનો તાંત્રિક અભિપ્રાય ફક્ત જે તે સર્વે નંબર/બ્લોક નંબર અથવા પ્લોટની જમીન પુરતો જ આપવામાં આવેલ છે.
૧૫. સવાલવાળી જમીનમાં આવવા જવા માટેના કાયદેસરના રસ્તા/પ્રવેશ અંગેની સ્થળે ચકાસણી સંબંધિત સક્ષમ અધિકારીશ્રી પાસેથી જમીન માલિક દ્વારા કરાવી લેવાની રહેશે.
૧૬. ઉદ્યોગ ખાતાના જે તે સંબંધિત અધિકારીશ્રીનો અભિપ્રાય મેળવી લેવાનો રહેશે.
૧૭. પ્રદૂષણ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સક્ષમ સત્તાધિકારીશ્રીનું ના વાંધા પ્રમાણપત્ર / અભિપ્રાય મેળવી લેવાનો રહેશે.
૧૮. લે-આઉટ પ્લાનમાં દર્શાવેલ કોમન પ્લોટની માલિકી સહિચારી રહેશે.
૧૯. સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના તા.૨૯-૦૫-૨૦૦૧ ના હુકમ નં.પરચ/૧૦૨૦૦૧/૪૫૫/લ તથા વખતો વખત સરકારશ્રી દ્વારા થયેલ હુકમો ની જોગવાઈઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
૨૦. સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના હુકમ નં. પરચ-૧૦૨૦૦૪-૧૯૬૧-લ, તારીખ: ૨૭-૦૭-૨૦૦૪ના વખતો વખત સરકારશ્રી દ્વારા થયેલ હુકમો અન્વયે વરસાદી પાણીના ભૂતળવહન માટેની જોગવાઈઓ કરવાની રહેશે.
૨૧. એક કરતાં વધારે રે.સ.નં./બ્લોક નં. માટે સંયુક્ત લે-આઉટ નકશો/બાંધકામ નકશાના કિસ્સાઓમાં બાંધકામ મંજૂરી/બાંધકામ કરતા પહેલા સંબંધિત અધિકારી/કચેરી પાસેથી એકત્રિકરણ કરાવી લેવાનું રહેશે.
૨૨. લે-આઉટ પ્લાનમાં દર્શાવેલ ક્રોસ ઓવર રોડ જાહેર રસ્તા તરીકે રહેશે તથા સરકારશ્રીના અન્ય લાગુ હુકમોની જોગવાઈઓ/નિયમાનુસાર અમલીકરણ કરવાનું રહેશે.
૨૩. આ અભિપ્રાયથી સવાલવાળી જમીનમાં સ્થળ પર જો કોઈ હયાત બાંધકામ હોય તો તેની પરવાનગી તથા મંજૂરી મળતી નથી. જેથી સ્થળ પરના હયાત બાંધકામની સક્ષમ અધિકારીશ્રી દ્વારા ખાતરી/ચકાસણી કરાવી તે મુજબની આગળની કાર્યવાહી કરવાની રહેશે.


૨૪. મોજે: પીપળી ના હયાત વિકાસને ધ્યાને લઈ સૂચિત સદર વિકાસ અર્થે જાહેર હિતમાં સરકારશ્રીની અમલી નિતિઓ મુજબ પૂરી પાડવાની થતી પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી, ગટર, વરસાદી પાણીનો નિકાલ, પાતાળકુવા/શોષ કુવા, ટ્રાફિક તથા અન્ય બાબતો ધ્યાને લઈ ત્યારબાદ જ યોગ્ય જણાય તો જ આગળની કાર્યવાહી થાય.
૨૫. સવાલવાળી જમીનમાં આંતરમાળખાકીય સવલતો(પાણી,ગટર,સ્ટ્રીટ લાઈટ, સોલીડ વેસ્ટના નિકાલ માટે) જાળવણી/ નિભાવણી ની યોગ્ય વ્યવસ્થા ડેવલપર/જમીન માલિકશ્રીએ કરવાની રહેશે.
૨૬. સવાલવાળી જમીનને લાગુ રસ્તાથી મળતા પ્રવેશ તથા તેની હયાતી, કાયદેસરતા ,વર્ગીકૃતતા અને પહોળાઈ બાબતે બાબતે સક્ષમ અધિકારીશ્રી દ્વારા ચકાસણી કરાવી લેવાની રહેશે. તથા રસ્તાની મધ્યરેખાથી બાંધકામ સંદર્ભે છોડવી પડતી બાંધકામ રેખા તથા નિયંત્રણ રેખાના નિયમોનું પાલન કરવાનું રહેશે. અન્યથા સદર અભિપ્રાય રદ ગણાશે.
૨૭. આ અભિપ્રાય અરજદારશ્રી, એન્જીનીયરશ્રી/ આર્કિટેક્ટશ્રી/ રજુ કરનાર એજન્સી દ્વારા રજુ કરવામાં આવેલ વિગતોના આધારે આપવામાં આવેલ છે રજુ કરેલ વિગતોમાં વિસંગતતા ઉદ્ભવેથી / એકપણ કે તેથી વધુ વિગતો ખોટી હોવાનું જાહેર થયેથી આ અભિપ્રાય રદ થયેલ ગણાશે.તેમજ તેની સઘળી જવાબદારી અરજદારશ્રી, એન્જીનીયરશ્રી/ આર્કિટેક્ટશ્રી/ રજુ કરનાર એજન્સીની રહેશે.
૨૮. સવાલવાળી જમીનના તમામ સ.નં. અંગે ૭/૧૨,તમામ એન્ડ્રી, સત્તા પ્રકાર, પોત ખરાબો, માપણી શીટ, સંપાદિત જમીનોના ક્ષેત્રફળની ચકાસણી તથા સવાલવાળી જમીનની માલિકી, ક્ષેત્રફળ, હદ માપ, ૭/૧૨ના ઉતારા, બીજા હકક, હકક પત્રક, નોંધ, કોર્ટ મેટર,વાંધા વિવાદ, કુલમુખત્યારનામુ, હક્ક/હિત, રસ્તા કરાર, રસ્તાની અધિકૃતતા/ઉપલબ્ધતા, પ્રવેશ સવાલવાળી જમીનમાં કોઈ દાવો થયેલ હોય તો તમામ બાબતોની ચકાસણી બિનખેતી/બાંધકામની મંજૂરી આપતા સમયે જે તે સક્ષમ અધિકારીશ્રી મારફતે કરાવી લેવાની રહેશે.
૨૯. સદરહુ જમીન/મિલકત અંગે કોઈ કોર્ટ વિવાદ કે લવાદ હોય તો જે તે સંલગ્ન કોર્ટના નિર્ણય તથા સંબંધિત કાયદાની જોગવાઈઓને આધિન રહેશે.
૩૦. સવાલવાળી જમીનમાં આયોજન કરેલ સૂચિત બાંધકામ અંગે પર્યાવરણ ની જાળવણી માટે નિયમાનુસાર સૌ પ્રથમ સંબંધિત અધિકારીશ્રીનો અભિપ્રાય મેળવી લેવાનો રહેશે.ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
૩૧. સવાલવાળી જમીનને નદી/ કેનાલ/ વહોળા/ તળાવ વિગેરેની અસર થતી હોય તો મધ્ય કે હદ રેખાથી છોડવા પડતા માર્જીન અંતરે બાબતે નર્મદા જળ સંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સચિવાલયના તા.૨૧/૦૮/૨૦૧૮ના પરિપત્ર ક્રમાંક :એમ.આઇ.એસ./૧૦૨૦૧૦:૧૭૧-ક ની જોગવાઈઓ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને તે અંગે જરૂરી સુધારા કરાવાના થતા હોય તો કરાવી, સંબંધિત ખાતાનો સૌપ્રથમ અભિપ્રાય મેળવી લેવાનો રહેશે.
૩૨. સવાલવાળી જમીનની આજુબાજુમાં અભયારણ્ય, જેલ, એરપોર્ટ, એસ.આઈ.આર., આર્કીયોલોજી કે અન્ય વિભાગને લગતા કાયદાઓ/ નિયંત્રણો અન્વયે અરજદારશ્રીએ સૌ પ્રથમ ના-વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
૩૩. સવાલવાળી જમીનમાં રજુ કરેલ બાંધકામ અંગે સંબંધિત વિભાગ/સરકારી/અર્ધસરકારી/નિગમો/બોર્ડ વિગેરે તરફથી મેળવવાના થતા " ના વાંધા પ્રમાણપત્ર " મેળવી લેવાના રહેશે. તથા તે પછી જ બાંધકામની મંજૂરી સંબંધિત કચેરી દ્વારા આપવાની રહેશે.
૩૪. સદર જમીનમાં સત્તામંડળ/ઓથોરીટી દ્વારા એમના વિસ્તારના તથા બહારના વિસ્તાર માટે કોઈપણ આયોજન જેમ કે રોડ નેટવર્ક વિગેરે ચાલતી હોઈ અથવા ભવિષ્યમાં થનાર હોઈ અને એની અસર સવાલવાળી જમીનને થશે તો તે મુજબ સંપાદન/કપાત થતી હોઈ તે ધ્યાને લઈ સદર નક્ષા રીવાઈઝ્ડ કરવાના રહેશે.
૩૫. સોલીડ વેસ્ટ તથા વોટર ડિસ્પોઝલ માટે સોઈલ સ્યુટેબલીટી રિપોર્ટને આનુસંગિક હાયજીનીકલી ડિસ્પોઝલ તથા મેઈન્ટેનન્સની યોગ્ય વ્યવસ્થા સહનું આયોજન અને અમલીકરણ કરવાની સંપૂર્ણ જવાબદારી ડેવલપર/જમીન માલિકની રહેશે.પ્રશ્નવાળી જમીનમાં સૂચિત વિકાસ અન્વયે તમામ આંતરમાળખાકીય સવલતોનો વિકાસની જાળવણી/નિભાવણી કરવાની જવાબદારી ડેવલપર/જમીન માલિકોની રહેશે.
૩૬. સ્યુએજ વેસ્ટ વોટરનું પૂર્ણ વૈજ્ઞાનિક ઢબે શુદ્ધિકરણ કરી, સદર શુદ્ધ થયેલ પાણીનો નિકાલ પ્રશ્નવાળી જમીનમાં જ બાગ-બગીચા વિગેરે માટે થાય તેમ 'ઝીરો વેસ્ટ વોટર આઉટ સાઈડ ડિસ્પોઝલ'નું આયોજન અને અમલીકરણ કરવાની સંપૂર્ણ જવાબદારી ડેવલપર/જમીન માલિકની રહેશે.
૩૭. સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૧૨/૧૦/૨૦૧૭ ના અધિસૂચના ક્રમાંક:જીએચ/વી/ ૨૦૧૭ નો ઇડીબી-૧૦૨૦૧૬-૩૬૨૯-લ થી પ્રસિધ્ધ થયેલ સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમોની જોગવાઈઓ તથા વખતો વખત તેમા થયેલ સુધારા-વધારા અનુસાર વરસાદી પાણીના ભુગર્ભ વહન/સંચય માટે તથા વૃક્ષા રોપણ/ વનીકરણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા બાબતની ઘટિત કાર્યવાહી નક્ષા મંજૂર કરવાની સત્તા ધરાવતા સત્તા તંત્ર દ્વારા કરવાની/કરાવવાની રહેશે.તે મુજબ અમલ કરાવવાનો રહેશે.

૩૮. સદર બાંધકામ બાબતે, અધિકૃત સંસ્થામાંથી સવાલવાળી જમીનનો સોઇલ ટેસ્ટીંગ રીપોર્ટ મેળવી તે મુજબ સ્ટ્રક્ચરલ ડીઝાઇન તૈયાર કરી અરજદારશ્રી/ ડેવલોપર્સશ્રી/ જમીનમાલિકશ્રી એ બાંધકામ કરવાનું રહેશે.
૩૯. ફાયર સેફ્ટી માટે સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલ અમલી કાયદા/નિયમોનુસાર અરજદારશ્રી/ડેવલોપર્સશ્રીએ જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે તથા તે અંગેનું જરૂરી "ના વાંધા પ્રમાણપત્ર" જે તે સક્ષમ અધિકારીશ્રી પાસેથી અચુકપણે પોતાની જવાબદારીએ મેળવી લેવાનું રહેશે અને ત્યારબાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
૪૦. નેશનલ બિલ્ડીંગ કોડ-IS-2470 તથા CGDCR Part- III ના નિયમ ૧૩.૧૦.૧ મુજબ સેપ્ટિક ટેન્ક તથા સોક પીટનું આયોજન કરવાનું રહેશે. અને તે અંગેની સંપૂર્ણ જવાબદારી આર્કિટેક્ટ/એન્જીનિયર/ડેવલોપર્સ/જમીન માલિકની રહેશે.
૪૧. મુખ્ય રસ્તાથી સવાલવાળી જમીન સુધી પ્રવેશ અંગે, યોગ્ય ચકાસણી/ખરાઇ સક્ષમ અધિકારીશ્રી પાસેથી કરાવી લેવાની રહેશે, ત્યારબાદ જ વિકાસ પરવાનગી મેળવવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે.
૪૨. સવાલવાળી જમીનમાં સરકારશ્રીના મંજૂર/અમલી નિયમો જેમકે સી.જી.ડી.સી.આર., ફાયર રેગ્યુલેશન વિગેરેની બાંધકામ સંબંધિત, લે-આઉટના આયોજન સંબંધિત, ટ્રી-પ્લાન્ટેશન, પરકોલેટીંગ વેલનું આયોજન વિગેરેની બાબતોનું અચુક પાલન કરવાનું રહેશે.
૪૩. ખુલ્લી રહેતી જમીનો અંગે જે તે સત્તામંડળના વખતો વખતના નિયમો અને વિકાસ યોજના/નગર રચના યોજનાના નિયંત્રણો લાગુ પાડવાના રહેશે.
૪૪. સરકારશ્રીના વખતો વખતના નિયમો અને નિયંત્રણોનું યોગ્ય રીતે પાલન કરવાનું રહેશે.
૪૫. અરજદારશ્રીએ પ્રકરણ સહ રજુ કરેલ સાધનીક કાગળો તથા આધાર પુરાવાઓને ધ્યાને લઈ સદર અભિપ્રાય આપવામાં આવેલ હોય, તેમાં જો કોઈ પણ વિસંગતતા ઉદ્ભવે/વિગતો ખોટી રજુ કરાયેલ હોય તેવું જાહેર થયેથી, આ અભિપ્રાય આપો આપ રદ ગણવાનો રહેશે.
૪૬. અરજદારશ્રીએ અત્રે રજુ કરેલ તા.૨૦/૧૧/૨૦૨૫ ના રૂ.૩૦૦/- ના જનરલ સોગંદનામાની વિગતો અરજદારશ્રીને બંધનકર્તા રહેશે. તેમજ તેમાં વિસંગતતા ઉદ્ભવેથી અત્રેની કચેરીનો અભિપ્રાય રદ ગણવાનો રહેશે.
૪૭. કાર્યપાલક ઈજનેરશ્રી, મા.મ.પંચાયત વિભાગ, અમદાવાદના જા.નં.ડીપી/બકમ/સીબી/વશીર૨૪/૨૦૨૫, તા.૨૯/૧૨/૨૦૨૫ ના અભિપ્રાય મુજબ બાંધકામ રેખા તથા નિયંત્રણ રેખા બાબતોના નિયમો તથા શરતોનું પાલન કરવાનું રહેશે.
૪૮. રહેણાંક (DW-1+DW-2) + RELIGIOUS (REG) હેતુ માટે પોલીસ ખાતાના "ના વાંધા પ્રમાણપત્ર" જે તે સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવી લેવાનું રહેશે.

આમ, મોજે.પીપળી, તા.ધોલેરા, જિ.અમદાવાદના સીટી સર્વે નં. NA૧૨૯/૧, NA૧૩૦ (જુના સ.નં./બ્લોક નં.૭૩૧, ૭૩૨/૨) ની ૨૮,૨૫૫.૦૦ ચો.મી. જમીનમાં રહેણાંક (DW-1+DW-2) + RELIGIOUS (REG) હેતુ માટેના લે-આઉટ પ્લાન તાંત્રિક ચકાસણી સાડુ આપે અત્રે રજુ કરેલ છે. સદર જમીનના લે-આઉટ પ્લાનના શરતી તાંત્રિક અભિપ્રાય બાબતેના નકશાની બે નકલો આ સાથે સામેલ છે, જે વિદિત થાય.

બિડાણ: ઉપર મુજબ.

અર્થે રજુ થયેલ પ્લાનમાં સહી સિક્કા કરેલ સ્ટ્રક્ચરલ એન્જીનીયરશ્રી, આર્કિટેક્ટશ્રીના નામ ઓજેક્ટના સાહિત્ય/ખામગીમાં તથા સ્થળે સાર્જન બોર્ડ ઉપર દર્શાવવાના રહેશે.



નગર નિયોજક

અમદાવાદ

નકલ સવિનય રવાના:

જિલ્લા કલેક્ટરશ્રી, અમદાવાદ તરફ જાણ તથા જરૂરી કાર્યવાહી સાડુ.